

તમારા બાળકને રિમોટલી ટરેનિંગમાં મદદ કરવી

1. સ્પષ્ટ નિયમો રાખો કારણ કે તે તમારા બાળકને વ્યવસ્થિત બનાવજે અને ખુશ રાકજે.

2. તમારું બાળક સામાન્ય શાળા સમયપત્રકનું પાલન કરવું જોઈએ.

3. ઘોંઘાટ તમારા બાળકના અભ્યાસ માટે મદદ કરશે નહીં.

4. તમારા બાળક સાથે તેમના શાળાકીય કાર્ય વિશે વાત કરો - તેમને પ્રશ્નો પૂછો, પ્રયાસ કરો તેમના માટે પ્રશ્નોના જવાબ

ન આપવા,

તેઓ કેવી રીતે સમસ્યાઓ હલ કરી શકે છે તે વિશે વિચારવામાં સહાય કરો.

તમે આ અંગ્રેજીમાં અથવા તમારી ઘરેલુ ભાષામાં કરી શકો છો.

5. તમારી ઘરની ભાષાઉપયોગ ચાલુ રાખો. સ્કૂલ માટે તમારી ઘરની ભાષા ઉપયોગ કરવાના ઘણા સકારાત્મક ફાયદા છે.

6. ખાતરી કરો કે તમારા બાળકને નિયમિત ચારામ મડે છે.

7. શાંત અને સકારાત્મક રહો. તમારા બાળકને તેઓ જે કાર્ય કરે છે તેના માટે બક્ષિસ આપો.

8. તમારા બાળકની જરૂર હોય તો સ્કૂલ ને મદદ માટે પૂછો.